

ત્વરિત જાહેરાત માટે

બ્રમ્પટનનો અનુભવ માણો! સીટી ઓફ બ્રમ્પટન પોતાની પહેલી ટુરિઝમ સ્ટ્રેટેજી વિકસાવી રહ્યું છે

બ્રમ્પટન, ઓન્ટેરિયો (જૂન 3, 2020) – સીટી ઓફ બ્રમ્પટન એક ઊભરી રહેલા મહત્વના પર્યટન નિર્ધારિત સ્થળ અને સાંસ્કૃતિક હોટસ્પોટ (મહત્વના સ્થળ) તરીકે, કન્સલ્ટન્ટ્સ બેનિકિન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ (Bannikin Travel & Tourism) અને કલિનરી ટુરિઝમ એલાયન્સ (Culinary Tourism Alliance) દ્વારા વિકસાવવામાં આવેલી પાંચ વર્ષની પર્યટન વ્યૂહરચનાની (ટુરિઝમ સ્ટ્રેટેજીની) ઘોષણા કરવામાં ગૌરવ અનુભવે છે.

વ્યૂહરચનામાં કાર્યનો મુખ્ય ઘટક રહેવાસીઓ, મુલાકાતીઓ, પર્યટન હિતધારકો અને ઉદ્યોગના પ્રતિનિધિઓને પ્રવૃત્તમય રાખવાનો રહેશે, જેમાં સ્થાનિક આકર્ષણ સંચાલકો (એટ્રેક્શન ઓપરેટર્સ), સાંસ્કૃતિક સંસ્થાઓ, ઇવેન્ટ પ્રોડ્યુસર્સ, આવાસીય સગવડ પૂરી પાડનારાઓ અને રેસ્ટોરન્ટ મેનેજરો સામેલ હશે જેઓના મંતવ્યો પર્યટન વ્યૂહરચનાના વિકાસને માર્ગદર્શન આપવામાં મદદરૂપ થશે.

આ વ્યૂહરચના બ્રમ્પટનના પર્યટન ક્ષેત્ર પર COVID-19 મહામારીથી થયેલા પ્રભાવોને સંબોધશે અને સ્થાનિક પર્યટન વધારવાની તકો ઓળખી કાઢશે, જ્યાં રહેવાસીઓ પોતાના શહેરમાં પ્રવાસ કરી શકે અને શોધખોળ કરી શકે. ઓન્ટેરિયોના ટુરિઝમ ઇન્ફર્મેશન એસોસિએશન અનુસાર, સ્થાનિક અને પ્રાદેશિક પર્યટન ઓન્ટેરિયોના પર્યટન ક્ષેત્રની ટૂંકા સમયગાળામાં આર્થિક રિકવરી મેળવવામાં નિર્ણાયક ફાળો આપનાર અને તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

આ વ્યૂહરચના શહેરના કલ્ચર માર્કેટ પ્લાન, આર્થિક વિકાસ વ્યૂહરચના, અને તાજેતરમાં મંજૂર કરેલી આર્થિક રિકવરી વ્યૂહરચનાને અનુરૂપ રહેશે. દરેક વ્યૂહરચના કળા, સંસ્કૃતિ અને પર્યટનને લચીલું અને સ્પર્ધાત્મક બ્રમ્પટનની આધારશિલા તરીકે ઓળખે છે.

આ શહેરનો હેતુ વર્ષ 2020 નાં શિયાળામાં બ્રમ્પટન સીટી કાઉન્સિલને બ્રમ્પટનની પહેલી પર્યટન વ્યૂહરચના રજૂ કરવાનો છે. અદ્યતન માહિતી માટે વેબસાઇટ જુઓ, www.brampton.ca/tourism.

બેનિકિન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ (Bannikin Travel & Tourism) વિશે

બેનિકિન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ટોરોન્ટો સ્થિત પર્યટન સ્થળ વિકાસ, પ્રવાસ વેપાર વિકાસ, સામેલ માહિતી અને મીડિયા સંબંધો માટે કટિબદ્ધ કન્સલ્ટિંગ પેઢી છે, જે એકાગ્ર પર્યટન અને સામાજિક અને સાંસ્કૃતિક રીતે જવાબદાર પ્રવાસમાં નિપુણતા ધરાવે છે.

બેનિકિને ઓકવિલ, સીટી ઓફ ઓરિલિયા અને ગ્રે કાઉન્ટીની મુલાકાત માટે એકસરખા પ્રોજેક્ટ્સને તાજેતરમાં સહાયતા કરી છે, અને હાલમાં પીટરબરો એન્ડ ધ કાવાર્થાસ અને પ્રિન્સ એડવર્ડ કાઉન્ટી માટે પર્યટન રિકવરી વ્યૂહરચનાઓ પર સલાહ-મસલત કરી રહ્યું છે.

કલિનરી ટુરિઝમ એલાયન્સ (Culinary Tourism Alliance) વિશે

કલિનરી ટુરિઝમ એલાયન્સ ટોરોન્ટો સ્થિત નફો ન રળનારી ખાદ્ય પદાર્થ પર્યટન વિકાસ સંસ્થા છે. તેનું લક્ષ્ય ખાદ્ય પદાર્થ પર્યટન સ્થળ અને વિકાસમાં વૈશ્વિક આગેવાન બનવાનું ચાલુ રાખીને ખાદ્ય પદાર્થ અને પીણાં ઉદ્યોગ અને પ્રવાસ ઉદ્યોગ વચ્ચેના અંતરને દૂર કરવાનું છે.

અવતરણો (ક્વોટ્સ):

“હું બ્રેમ્પટનની પહેલી પર્યટન વ્યૂહરચનાના વિકાસને સહાયરૂપ થવામાં રોમાંચિત છું. આ વ્યૂહરચના પર કામ શરૂ કરવું એ COVID-19 કટોકટીમાંથી આપણાં શહેરને બહાર નીકળવામાં મદદરૂપ થવામાં એક મહત્વનું સીમાચિહ્ન બની રહેશે. આપણો સમુદાય પ્રતિભાશાળી વ્યક્તિઓથી ભરપૂર છે અને આપણું શહેર ગર્ભિત રત્નોથી ભરેલું છે, અને હું દરેક વ્યક્તિને બ્રેમ્પટનને અનુભવવા આમંત્રિત કરું છું!”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટનવાસીઓ, હિતધારકો અને ઉદ્યોગ નિષ્ણાતો આપણાં શહેરની પહેલી પર્યટન વ્યૂહરચનાનો આકાર ઘડવા એકસાથે આવી રહ્યાં છે. લાંબા-ગાળાની આર્થિક રિકવરી માટે ઉકેલો ઘડવા સક્રિય રહેવું નિર્ણાયક બને છે, ખાસ કરીને જ્યારે આપણે આ મહામારીમાંથી બહાર નીકળવાના પ્રયત્નમાં છીએ. હું બ્રેમ્પટનને પર્યટન માટે નિર્ધારિત સ્થળ તરીકે અને રહેવાસીઓ અને મુલાકાતીઓ માટે એકસરખા સાંસ્કૃતિક હોટસ્પોટ તરીકે પ્રકાશિત કરવા આશાવાદી છું.”

- હરકિરત સિંહ (Harkirat Singh), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 9 અને 10, સીટી ઓફ બ્રેમ્પટન; અધ્યક્ષ, કોર્પોરેટ સેવાઓ

“બ્રેમ્પટન કળા અને સંસ્કૃતિથી ભરપૂર એક ગતિશીલ શહેર છે. આપણાં ધંધાઓ, આયોજનો, અને ઉદ્યાનો આ મહાન શહેરના માત્ર થોડાક જ આકર્ષણો છે જે આપણને અલગ પાડે છે. બ્રેમ્પટનની પહેલી પર્યટન વ્યૂહરચના આપણને COVID-19 થી થયેલા પ્રભાવોમાંથી આર્થિક રિકવરી તરફ લઈ જશે, અને આપણાં સમુદાયને લાયક તેજસ્વી પ્રકાશ સમુદાય પર ચમકાવશે.”

- રોવેના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5, સીટી ઓફ બ્રેમ્પટન; ઉપાધ્યક્ષ, કોર્પોરેટ સેવાઓ

“સીટી ઓફ બ્રેમ્પટન ટુરિઝમ એન્ડ ફિલ્મ ઓફિસે બ્રેમ્પટનમાં પર્યટન માટે સુદૃઢ માળખું બનાવવા બેનિકિન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ અને કલિનરી ટુરિઝમ એલાયન્સના નિષ્ણાતોને રોક્યા છે. પર્યટન વ્યૂહરચના બ્રેમ્પટનના ટૂંકા અને લાંબા-ગાળાના વિકાસને સંબોધશે, આર્થિક રિકવરી વ્યૂહરચનાને અનુરૂપ આર્થિક રિકવરી અને અતિ સ્થાનિક પહેલો પર ધ્યાન કેન્દ્રિત કરશે.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca